



MBW-001-011419 Seat No. _____
M. A. (Sem. IV) (CBCS) Examination
April / May - 2018
Economics : Paper - IV
(Econometric Applications)
(Old Course)

**Faculty Code : 001
Subject Code : 011419**

Time : $2\frac{1}{2}$ Hours] [Total Marks : 70

- | | | |
|---|---|----|
| ૧ | <p>અર્થમિતિશાસ્ત્રના અભ્યાસનું સ્વરૂપ અને વ્યાપ દ્વારાંતો સાથે સમજાવો.</p> <p>અથવા</p> <p>ટૂકડા ગાળા અને લાંબા ગાળાની આગાહીઓની પદ્ધતિઓ સમજાવો.</p> | ૧૪ |
| ૨ | <p>શ્રેષ્ઠ અન્વાયોજક રેખા મેળવવાની પદ્ધતિ વર્ણવો તથા તેની વિવિધ ધારણાઓ સમજાવો.</p> | ૧૪ |
| ૩ | <p>અથવા</p> <p>કોઈન્ટીગ્રેશન પદ્ધતિ સમજાવો તથા તેના ઉપયોગોની ચર્ચા કરો.</p> | ૧૪ |
| ૪ | <p>અર્થમિતિશાસ્ત્રીય સમસ્તલક્ષી આર્થિક મોડેલોના વિવિધ પાસાઓની સમજૂતી આપો અને તેનું મહત્વ સ્પષ્ટ કરો.</p> <p>અથવા</p> <p>આંતરરાષ્ટ્રીય વ્યાપારના સમસ્તલક્ષી આર્થિક મોડેલની રચના કરો અને તેની ધારણાઓ સ્પષ્ટ કરો.</p> | ૧૪ |
| ૫ | <p>ભારતીય અર્થતંત્રના સમસ્તલક્ષી આર્થિક મોડેલો વિષે તમારી ટીકા ટિપ્પણી લખો.</p> <p>અથવા</p> <p>મહાલાનોભિસના ભારતીય અર્થતંત્રના આર્થિક મોડેલની સમજૂતી લખો અને આપોજનમાં તેનું મહત્વ સમજાવો.</p> | ૧૪ |
| ૬ | <p>ટૂકડી નોંધ લખો : (કોઈપણ બે)</p> <p>(અ) BEST ગુણધર્મો</p> <p>(બ) બોક્સ - જેનકીન પદ્ધતિ</p> <p>(ક) બચત-મૂડીરોકાણ મોડેલ</p> <p>(દ) અ-સરેખ સહસંબંધ.</p> | ૧૪ |

ENGLISH VERSION

- 1** With help of illustrations explain structure and scope of study of econometrics. **14**

OR

Explain methods of forecasting for short-run and long-run. **14**

- 2** Describe method for estimating the line of best fit and explain its assumptions. **14**

OR

Explain method of cointegration in and discuss its uses. **14**

- 3** Explain various aspects of econometric macro-economic modelling and state its significance. **14**

OR

Construct macro econometric model for international trade and state its assumptions. **14**

- 4** Write your critical evaluation of Indian macro economic models. **14**

OR

Explain macro economic model of Mahalanobis for Indian economy and state its significance. **14**

- 5** Write short notes : (any two) **14**

- (a) BEST properties
- (b) Box – Jenkins method
- (c) Saving – Investment model
- (d) Non-linear regression.

